




॥ अटसंमदलक्षा मुखपाठ अर्धा ॥

आफ्रिका



Mahantji Shreni

64 Verses
Gujarati

Satsang Pravrutti Central Office, Africa


|| Shri Swaminarayan Vijayate ||




Bhagwan Swaminarayan and Aksharbrahman Gunatitanand Swami
(Shri Akshar-Purushottam Maharaj)




**Brahmaswarup
Bhagatji Maharaj**



**Brahmaswarup
Shastriji Maharaj**



**Brahmaswarup
Yogiji Maharaj**




**Brahmaswarup
Pramukh Swami Maharaj**



Pragat Brahmaswarup Mahant Swami Maharaj

I CAN, I WILL, I MUST
(CWM)
Sadhu Keshajivandas



Goal: Memorize 64 Shloks

Date	Milestone	Mukhpath Shloks	Total Shloks
Sunday, 28 Mar 2021	Pragatji Bhakta Jayanti	20	20
Sunday, 25 Apr 2021	Swaminarayan Jayanti	12	32
Sunday, 06 Jun 2021	Yogi Jayanti	24	56
Sunday, 11 Jul 2021	Final Round -1	08	64
Sunday, 18 Jul 2021	Final Round -2	Revision	64

१. स्वामिनारायण भगवान् ऐटले के साक्षात् अक्षरपुरुषोत्तम महाराज सर्वने परम शांति, आनंद अने सुख अर्पे. (१)

Swāminārāyaṇ Bhagwān eṭale ke sākṣhāt Akṣhar-Puruṣhottam Mahārāj sarvane param shānti, ānand ane sukh arpe. (1)

२. आ देह मुक्तिनुं साधन छे, केवल भोगनुं साधन नथी. दुर्लभ अने नाशवंत ऐवो आ देह वारंवार मगतो नथी. (२)

Ā deh muktinu sādhan chhe, keval bhognu sādhan nathī. Durlabh ane nāshvant evo ā deh vāramvār maḡato nathī. (2)

३. लौकिक व्यवहार तो देहना निर्वाह माटे छे. ते आ मनुष्य जन्मनुं परम लक्ष्य नथी. (३)

Laukik vyavahār to dehnā nirvāh māṭe chhe. Te ā manuṣhya janmanu param lakṣhya nathī. (3)

४-५. सर्व दोषोने टाणवा, ब्रह्मस्थितिने पामवा अने भगवान्नी भक्ति करवा आ देह मण्यो छे. आ भधुं सत्संग करवाथी अवश्य प्राप्त थाय छे. आथी मुमुक्षुओऐ सदाय सत्संग करवो. (४-५)

Sarva doṣhone ṭāḷavā, brahma-sthitine pāmavā ane Bhagwānnī bhakti karavā ā deh maḡyo chhe. Ā badhu satsang karavāthī avashya prāpta thāya chhe. Āthī mumukṣhuoē sadāya satsang karavo. (4-5)

६. तेथी परब्रह्म स्वामिनारायणे आ लोकमां साक्षात् अवतरिने आ दिव्य सत्संगनी स्थापना करी. (६)

Tethī Parabrahma Swāminārāyaṇē ā lokmā sākṣhāt avatarīne ā divya satsangnī sthāpanā karī. (6)

७. आ सत्संगनुं ज्ञान मुमुक्षुओने थाय अेवा शुभ आशयथी 'सत्संगदीक्षा' अे नामनुं शास्त्र रयवामां आवे छे. (७)

Ā satsangnu gnān mumukṣhuone thāya evā shubh āshayathī 'Satsang-Dikṣhā' e nāmnū shāstra rachavāmā āve chhe. (7)

- ८-८. सत्य अेवा आत्मानो संग करवो, सत्य अेवा परमात्मानो संग करवो, सत्य अेवा गुरुनो संग करवो अने सख्खास्त्रनो संग करवो अे सत्संगनुं सायुं लक्ष्ण ज्ञाणवुं. आवो दिव्य सत्संग करनार मनुष्य सुभी थाय छे. (८-८)

Satya evā ātmāno sang karavo, satya evā Paramātmāno sang karavo, satya evā guruno sang karavo ane sachchhāstrano sang karavo e satsangnu sāchu lakṣhaṇ jāṇavu. Āvo divya satsang karanār manuṣhya sukhī thāy chhe. (8-9)

१०. दीक्षा अेटले दृढ संकल्प, श्रद्धाअे सहित अेवो अयण निश्चय, सम्यक् समर्पण, प्रीतिपूर्वक निष्ठा, व्रत अने दृढ आशरो. (१०)

Dikṣhā eṭale dṛuḍh sankalp, shraddhāe sahit evo achal nishchay, samyak samarpaṇ, prīti-pūrvak niṣṭhā, vrat ane dṛuḍh āsharo. (10)

११. स्वामिनारायण भगवानने विषे अनन्य, दृढ अने परम भक्ति माटे आश्रयदीक्षा मंत्र ग्रहण करी सत्संग प्राप्त करवो. (१८)

Swāminārāyaṇ Bhagwānne viṣhe ananya, dṛuḍh ane param bhakti māṭe āshraya-dikṣhā-mantra grahaṇ karī satsang prāpta karavo. (18)

१२. आश्रयदीक्षा मंत्र आ प्रमाणे छे:

धन्योस्मि पूर्णकामोस्मि निष्पापो निर्भयः सुधी।
अक्षरगुरुयोगेन स्वामिनारायणश्रयात्॥ (१८)

Āshraya-dīkshā mantra ā pramāṇe chhe:

Dhanyosmi pūrṇakāmosmi niṣhpāpo nirbhayah sukhī ।

Akṣhara-guru-yogena Swāminārāyaṇ-āshrayāt ॥ (19)

१३. आ संसारमां ब्रह्मस्वरूप गुरु विना ज्वनमां ब्रह्मविद्यानो तत्त्वे करीने
साक्षात्कार न थई शके. (२२)

Ā sansārmā brahmaswarūp guru vinā jīvanmā brahma-vidyāno
tattve karīne sākṣhātkār na thāī shake. (22)

१४. अक्षरब्रह्म गुरु विना परमात्मानो उत्तम निर्विकल्प निश्चय न थई शके तथा
पोताना आत्माने विषे ब्रह्मभाव पण प्राप्त न थई शके. (२३)

Akṣharbrahma guru vinā Paramātmāno uttam nirvikalp
nishchay na thāī shake tathā potānā ātmāne viṣhe brahmabhāv
paṇ prāpta na thāī shake. (23)

१५. ब्रह्मस्वरूप गुरु विना यथार्थ भक्ति पण न थई शके, परम आनंदनी प्राप्ति
न थाय अने त्रिविध तापनो नाश पण न थाय. (२४)

Brahmaswarūp guru vinā yathārth bhakti paṇ na thāī shake,
param ānandnī prāpti na thāy ane trividh tāpano nāsh paṇ na
thāy. (24)

१६. आथी सर्व अर्थनी सिद्धि करे तथा परमात्मानो अनुभव करावे तेवा प्रत्यक्ष अक्षरब्रह्म गुरुनो आशरो सदाय करवो. (२५)

Āthī sarva arthnī siddhi kare tathā Paramātmāno anubhav karāve tevā pratyakṣ Akṣharbrahma guruno āsharo sadāy karavo. (25)

१७. अक्षराधिपति स्वामिनारायण भगवान साक्षात् परमात्मा परब्रह्म पुरुषोत्तम हरि छे. (८६)

Akṣharādhipati Swāminārāyaṇ Bhagwān sākṣhāt Paramātmā Parabrahma Puruṣhottam Hari chhe. (96)

१८. ऐ ऐक ज आपणा सदा परम उपास्य ईष्टदेव छे. तेमनी ज अनन्य भावे सदा भक्ति करवी. (८७)

E ek ja āpaṇā sadā param upāsyā iṣṭadev chhe. Temanī ja ananya bhāve sadā bhakti karavī. (97)

१९. गुणातीतानंद स्वामी साक्षात् सनातन अक्षरब्रह्म छे. ऐ अक्षरब्रह्मनी परंपरा आजे पण विराजमान छे. (८८)

Guṇātītānand Swāmī sākṣhāt sanātan Akṣharbrahma chhe. E Akṣharbrahmanī paramparā āje paṇ virājamān chhe. (98)

२०. संप्रदायमां गुणातीतानंद स्वामीथी आरंभायेल गुरुपरंपरामां आवेल प्रगत अक्षरब्रह्म ऐ ऐक ज आपणा गुरु छे. (८९)

Sampradāymā Guṇātītānand Swāmīthī ārambhāyēl guru-paramparāmā āvel pragaṭ Akṣharbrahma e ek ja āpaṇā guru chhe. (99)

૨૧. આપણા ઈષ્ટદેવ એક જ છે, ગુરુ એક જ છે અને સિદ્ધાંત પણ એક જ છે - એમ આપણી સદા એકતા છે. (૧૦૦)

Āpaṇā iṣṭadev ek ja chhe, guru ek ja chhe ane siddhānt paṇ ek ja chhe em āpaṇī sadā ekatā chhe. (100)

૨૨. બ્રહ્મવિદ્યારૂપ, વૈદિક અને સનાતન એવા દિવ્ય અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને જાણવો. (૧૦૧)

Brahma-vidyārūp, Vaidik ane sanātan evā divya Akṣhar-Puruṣhottam siddhāntne jāṇavo. (101)

૨૩-૨૪. જીવ, ઈશ્વર, માયા, અક્ષરબ્રહ્મ તથા પરબ્રહ્મ એ પાંચ તત્ત્વો સદાય ભિન્ન છે, નિત્ય છે, સત્ય છે એમ મુમુક્ષુઓએ જાણવું - એમ સ્વયં સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ સિદ્ધાંત કર્યો છે. (૧૦૨-૧૦૩)

Jīv, īshwar, māyā, Akṣharbrahma tathā Parabrahma e pānch tattvo sadāy bhinna chhe, nitya chhe, satya chhe em mumukṣhuoe jāṇavu - em swayam Swāminārāyaṇ Bhagwāne spaṣṭa siddhānt karyo chhe. (102-103)

૨૫. તેમાં અક્ષર અને પુરુષોત્તમ એ બે સદાય માયાથી પર છે અને જીવો તથા ઈશ્વરોની મુક્તિ તેમના યોગથી થાય છે. (૧૦૪)

Temā Akṣhar ane Puruṣhottam e be sadāy māyāthī par chhe ane jīvo tathā īshwaronī mukti temanā yogthī thāy chhe. (104)

૨૬. પરમાત્મા પરબ્રહ્મ સદા અક્ષરબ્રહ્મથી પર છે અને અક્ષરબ્રહ્મ પણ તે પરમાત્માની નિત્ય દાસભાવે સેવા કરે છે. (૧૦૫)

Paramātmā Parabrahma sadā Akṣharbrahmthī par chhe ane Akṣharbrahma paṇ te Paramātmānī nitya dāsabhāve sevā kare chhe. (105)

૨૭. ભગવાન સદાય સર્વકર્તા, સાકાર, સર્વોપરી છે અને મુમુક્ષુઓની મુક્તિ માટે હંમેશાં પ્રગટ રહે છે. (૧૦૬)

Bhagwān sadāy sarva-kartā, sākār, sarvoparī chhe ane mumukṣhuonī mukti māṭe hammeshā pragaṭ rahe chhe. (106)

૨૮. અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુ દ્વારા ભગવાન પોતાનાં સકળ ઐશ્વર્યો સહિત, પરમાનંદ અર્પતાં થકાં સદાય પ્રગટ રહે છે. (૧૦૭)

Akṣharbrahma-swarūp guru dvārā Bhagwān potānā sakal aishvaryo sahit, paramānand arpatā thakā sadāy pragaṭ rahe chhe. (107)

૨૯. અક્ષરબ્રહ્મ ગુરુને વિષે દૃઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવી. તેમને વિષે પ્રત્યક્ષ ભગવાનનો ભાવ લાવીને ભક્તિએ કરીને તેમની સેવા તથા ધ્યાન કરવાં. (૧૦૮)

Akṣharbrahma gurune viṣhe dṛuḍh prīti ane ātmabuddhi karavī. Temane viṣhe pratyakṣ Bhagwānno bhāv lāvīne bhaktie karīne temanī sevā tathā dhyān karavā. (108)

૩૦-૩૧. સ્વામિનારાયણ મંત્ર દિવ્ય, અલૌકિક અને શુભ મંત્ર છે. સ્વયં શ્રીહરિએ આ મંત્ર આપ્યો છે. સર્વ ભક્તોએ તેનો જપ કરવો. આ મંત્રમાં 'સ્વામિ' શબ્દથી અક્ષરબ્રહ્મને સમજવા અને 'નારાયણ' શબ્દથી તે અક્ષરબ્રહ્મથી પર એવા પુરુષોત્તમને સમજવા. (૧૦૯-૧૧૦)

Swāminārāyaṇ mantra divya, alaukik ane shubh mantra chhe. Swayam Shriharie ā mantra āpyo chhe. Sarva bhaktoe teno jap karavo. Ā mantramā 'Swāmi' shabdathī Akṣharbrahmane samajavā ane 'Nārāyaṇ' shabdathī te Akṣharbrahmathī par evā Puruṣhottamne samajavā. (109-110)

उ२-उ५. आ सिद्धांत भगवान् स्वामिनारायणे आ लोकमां प्रबोध्यो. गुणातीत गुरुओमे तेनुं दिगंतमां प्रवर्तन कर्तुं. शास्त्रीञ्च महाराजे तेने मूर्तिमान् कर्तुं. गुरुओना जवनचरित्र-ग्रंथोमां तेनी पुनः दृढता कराववामां आवी. आ सिद्धांतने गुरुहरि प्रमुखस्वामी महाराजे पोताना हस्ताक्षरथी लक्ष्मी स्थिर कर्तुं. साक्षात् गुरुहरिना प्रसंगथी आ सिद्धांत जवनमां प्राप्त करी शक्य छे. ते आ सनातन मुक्तिप्रद सिद्धांतने ज दिव्य 'अक्षरपुरुषोत्तम दर्शन' कहेवामां आवे छे. (१११-११४)

Ā siddhānt Bhagwān Swāminārāyaṇe ā lokmā prabodhyo. Guṇātīt guruoe tenu digantmā pravartan karyu. Shāstrīñ Mahārāje tene mūrtimān karyo. Guruonā jīvan-charitra-granthomā tenī punah dṛḍhatā karāvavāmā āvī. Ā siddhāntne guruhari Pramukh Swāmī Mahārāje potānā hastākṣharthī lakhī sthir karyo. Sākṣhāt guruharinā prasangthī ā siddhānt jīvanmā prāpt karī shakāy chhe. Te ā satya sanātan muktuprad siddhāntne ja divya 'Akṣhar-Puruṣhottam Darshan' kahevāmā āve chhe. (111-114)

उ६. आवा परम दिव्य सिद्धांतनुं चिंतवन करतां करतां निष्ठाथी अने आनंद-उत्साहपूर्वक सत्संग करवो. (११५)

Āvā param divya siddhāntnu chintavan karatā karatā niṣṭhāthī ane ānand-utsāh-pūrvak satsang karavo. (115)

उ७. त्रश देहथी विलक्षण एवा पोताना आत्माने विषे ब्रह्मरूपनी विभावना करी सदैव परब्रह्मनी उपासना करवी. (११६)

Traṣ dehthī vilakṣhaṇ evā potānā ātmāne viṣhe brahmarūpnī vibhāvanā karī sadaiv Parabrahmanī upāsana karavī. (116)

૩૮. ભગવાન તથા ગુરુને વિષે મનુષ્યભાવ ન જોવો, કારણ કે અક્ષર અને પુરુષોત્તમ બંને માયાથી પર છે, દિવ્ય છે. (૧૩૧)

Bhagwān tathā gurune viṣhe manuṣhyabhāv na jovo. Kāraṇ ke Akṣhar ane Puruṣhottam banne māyāthī par chhe, divya chhe. (131)

૩૯. ભગવાન તથા ગુરુને વિષે વિશ્વાસ દઢ કરવો, નિર્બળતાનો ત્યાગ કરવો, ધીરજ રાખવી તથા ભગવાનનું બળ રાખવું. (૧૩૨)

Bhagwān tathā gurune viṣhe vishvās dṛuḍh karavo, nirbaḷtāno tyāg karavo, dhīraj rākhavī tathā Bhagwānnu baḷ rākhavu. (132)

૪૦. મુમુક્ષુઓએ પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો પ્રસંગ સદા પરમ પ્રીતિ અને દિવ્યભાવથી કરવો. (૧૩૪)

Mumukṣhuoe pratyakṣh Akṣharbrahma guruno prasang sadā param prīti ane divyabhāvthī karavo. (134)

૪૧. અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુને વિષે દઢ પ્રીતિ એ જ બ્રાહ્મી સ્થિતિ તથા ભગવાનના સાક્ષાત્કારને પામવાનું સાધન છે. (૧૩૫)

Akṣharbrahma-swarūp gurune viṣhe dṛuḍh prīti e ja brāhmī sthiti tathā Bhagwānnā sākṣhātkārne pāmavānu sādhan chhe. (135)

૪૨. અક્ષરબ્રહ્મ ગુરુના ગુણો આત્મસાત્ કરવા માટે તથા પરબ્રહ્મની અનુભૂતિ માટે અક્ષરબ્રહ્મ ગુરુના પ્રસંગોનું સદાય મનન કરવું. (૧૩૬)

Akṣharbrahma gurunā guṇo ātmasāt karavā māṭe tathā Parabrahmanī anubhūti māṭe Akṣharbrahma gurunā prasangonu sadāy manan karavu. (136)

४३. मन-कर्म-वचने गुरुहरिनुं सदा सेवन करवुं अने तेमने विषे प्रत्यक्ष नारायणस्वरूपनी भावना करवी. (१३७)

Man-karma-vachane guruharinu sadā sevan karavu ane temane viṣhe pratyakṣh Nārāyaṅswarūpnī bhāvanā karavī. (137)

४४. सत्संगीअे क्यारेय बणरहित वात सांभणवी नहीं अने करवी पण नहीं. हुंमेशां बण भरेली वातो करवी. (१३८)

Satsangīe kyārey baḷ-rahit vāt sāmbhaḷavī nahī ane karavī paṅ nahī. Hammeshā baḷ bharelī vāto karavī. (138)

४५. प्रेमे करीने तथा आदर थकी ब्रह्म अने परब्रह्मना महिमानी तथा तेमना संबंधवाणाना महिमानी वातो निरंतर करवी. (१३९)

Preme karīne tathā ādar thakī Brahma ane Parabrahmanā mahimānī tathā temanā sambandh-vāḷānā mahimānī vāto nirantar karavī. (139)

४६. मुमुक्षुअे सत्संगीओने विषे सुहृदभाव, दिव्यभाव तथा ब्रह्मभाव राखवा. (१४०)

Mumukṣhue satsangīone viṣhe suhṛudbhāv, divyabhāv tathā brahmabhāv rākhavā. (140)

४७-४८. परमात्मा परब्रह्म स्वामिनारायण भगवान, अक्षरब्रह्मस्वरूप गुणातीत गुरु, तेमण्णे आपेल दिव्य सिद्धांत तथा तेमना आश्रित भक्तोनो विवेके करीने सदाय पक्ष राखवो. (१४१-१४२)

Paramātmā Parabrahma Swāminārāyaṅ Bhagwān, Akṣharbrahma-swarūp guṅātīt guru, temaṅe āpel divya siddhānt tathā temanā āshrit bhaktono viveke karīne sadāy pakṣh rākhavo. (141-142)

४८. प्रतिदिन स्थिर चित्ते अंतदृष्टि करवी के हुं आ लोकमां शुं करवा आव्यो छुं?
अने शुं करी रह्यो छुं? (१४५)

Pratidin sthir chitte antardrūṣṭi karavī ke hu ā lokmā shu
karavā āvyo chhu? Ane shu karī rahyo chhu? (145)

५०. 'अक्षररूप थईने हुं पुरुषोत्तमनी भक्ति करुं' ऐम पोताना लक्ष्यनुं चिंतन
आणस राभ्या वगर रोज करवुं. (१४६)

'Akṣharrūp thaīne hu Puruṣhottamnī bhakti karu' em potānā
lakṣhyanu chintan ālas rākhyā vagar roj karavu. (146)

५१-५२. आ स्वामिनारायण भगवान सर्वकर्ताहर्ता छे, सर्वोपरी छे, नियामक छे. तेओ
मने अहीं प्रत्यक्ष मय्या छे. आथी ज हुं धन्य छुं, परम भाग्यशाणी छुं, कृतार्थ
छुं, निःशंक छुं, निश्चिंत छुं अने सदा सुभी छुं. (१४७-१४८)

Ā Swāminārāyaṇ Bhagwān sarva-kartā-hartā chhe, sarvoparī
chhe, niyāmak chhe. Teo mane ahī pratyakṣ malyā chhe. Āthī ja
hu dhanya chhu, param bhāgyashālī chhu, kṛtārth chhu,
nihshank chhu, nishchint chhu ane sadā sukhī chhu. (147-148)

५३. आ रीते परमात्मानी दिव्य प्राप्तिनुं, महिमानुं तथा तेमनी प्रसन्नतानुं चिंतन
दररोज स्थिर चित्ते करवुं. (१४९)

Ā rīte Paramātmānī divya prāptinu, mahimānu tathā temanī
prasannatānu chintan dar-roj sthir chitte karavu. (149)

५४. पोताना आत्माने त्रण देह, त्रण अवस्था तथा त्रण गुणथी जुदो समञ्ज तेनी
अक्षरब्रह्म साथे ऐकतानी विभावना प्रतिदिन करवी. (१५०)

Potānā ātmāne traṇ deh, traṇ avasthā tathā traṇ guṇthī judo
samajī tenī Akṣharbrahma sāthe ekatānī vibhāvanā pratidin
karavī. (150)

૫૫. દરરોજ જગતના નાશવંતપણાનું અનુસંધાન કરવું અને પોતાના આત્માની નિત્યતા તથા સચ્ચિદાનંદપણાનું ચિંતવન કરવું. (૧૫૧)

Dar-roj jagatnā nāshavant-pañānu anusandhān karavu ane potānā ātmānī nityatā tathā sachchidānand-pañānu chintavan karavu. (151)

૫૬. જે થઈ ગયું છે, થઈ રહ્યું છે અને જે કાંઈ આગળ થશે, તે બધું જ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી મારા હિત માટે જ થયું છે એમ માનવું. (૧૫૨)

Je thaī gayu chhe, thaī rahyu chhe ane je kāñī āgaḷ thashe te badhu ja Swāminārāyaṇ Bhagwāññī ichchhāthī mārā hit māṭe ja thayu chhe em mānavu. (152)

૫૭. માન, ઈર્ષ્યા, કામ, ક્રોધ ઈત્યાદિ દોષોનો આવેગ આવે ત્યારે ‘હું અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું’ એમ શાંત મને ચિંતવન કરવું. (૧૫૪)

Mān, irṣhyā, kām, krodh ityādi doṣhono āveg āve tyāre ‘Hu Akṣhar chhu, Puruṣhottamno dās chhu’ em shānt mane chintavan karavu. (154)

૫૮. અને સર્વ દોષોનું નિવારણ કરનારા સાક્ષાત્ સ્વામિનારાયણ ભગવાન સદૈવ મારી સાથે છે એમ બળ રાખવું. (૧૫૫)

Ane sarva doṣhonu nivāraṇ karanārā sākṣhāt Swāminārāyaṇ Bhagwān sadaiv māri sāthe chhe em baḷ rākhavu. (155)

૫૯. અસત્ય ક્યારેય ન બોલવું. હિત કરે તેવું સત્ય બોલવું. અન્યનું અહિત કરે તેવું સત્ય પણ ન બોલવું. (૧૬૪)

Asatya kyārey na bolavu. Hit kare tevu satya bolavu. Anyanu ahit kare tevu satya paṇ na bolavu. (164)

६०. सुખमां छकी न जवुं अने दुःखमां उद्वेग न पामवो. कारण के अधुं
स्वामिनारायण भगवाननी छच्छाथी प्रवर्ते छे. (१६८)

Sukhmā chhakī na javu ane dukhmā udveg na pāmavo. Kāraṇ ke
badhu Swāminārāyaṇ Bhagwānī ichchhāthī pravarte chhe.
(169)

६१. कुमार तथा युवान अवस्थामां विशेष संयम पाणवो. शक्तिनो नाश करे अेवा
अयोग्य स्पर्श, दृश्य वगेरेनो त्याग करवो. (२१३)

Kumār tathā yuvān avasthāmā viśeṣh sanyam pāḷavo. Shaktino
nāsh kare evā ayogyā sparsh, dṛushya vagereno tyāg karavo.
(213)

६२. धर्म-नियम पाणवाथी जिवन उन्नत थाय छे अने अन्यने पण सदायार
पाणवानी प्रेरणा मणे छे. (२७४)

Dharma-niyam pāḷavāthī jīvan unnat thāy chhe ane anyane paṇ
sadāchār pāḷavānī preraṇā maṇe chhe. (274)

६३. शुभ तथा अशुभ प्रसंगोने विषे महिमाअे सहित पवित्र सहजानंद
नामावलीनो पाठ करवो. (२७६)

Shubh tathā ashubh prasangone viṣhe mahimāe sahit
pavitra Sahajānand Nāmāvalīno pāṭh karavo. (276)


६४. अक्षरब्रह्मनुं साधर्म्य प्राप्त करी पुरुषोत्तमनी दासत्वावे भक्ति करवी अे मुक्ति
मानवामां आवी छे. (२८१)

Akṣharbrahmanu sādharma prāpt karī Puruṣhottamnī
dāsabhāve bhakti karavī e mukti mānavāmā āvī chhe. (291)

Notes







सत्संगा-दीक्षा नो
मुखपाठ =
अक्षरधाम ।
२०२३

॥ सत्संगदीक्षा मुखपाठ अर्धा ॥
ऑफ़िका

Blessings
Pramukh Swami Maharaj



Inspirer
Mahant Swami Maharaj